



જનસંપર્ક અધિકારી દ્વારા
પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર
ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૭/૦૨/૨૦૧૯ રવિવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગારધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૦૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૫૭ કેસ કરી, ૪૦ વ્યક્તિઓને ઝડપી, ૧૬૬ લીટર દેશી દારૂ, ૪૩૨ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧૨ ક્વાર્ટર ઈંગ્લીશ દાર અને ૧ કાર કબજે કરી હતી. તેમજ જુગારધારા હેઠળ ૩ કેસ કરી ૧૬ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૨૦,૪૩૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૩૦૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૮૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રોહી.૯૩ મુજબ ૧૧ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ચોરી :-

સમાચાર યાદી નં.૩૧૦/૧૯

સોલા હાઇકોર્ટ: દિપકભાઈ દશરથભાઈ પટેલ (ઉ.વ.૫૨)(રહે. કુંજ બંગલોઝ પંચમ થાળ પાછળ સાયન્સ સીટી રોડ સોલા) તા.૧૬/૨/૧૯ બપોરના ૧/૦૦ વાગ્યાના સુમારે સોલા સાયન્સ સીટી રોડ એમ્પયાર બીઝનેશ હબ નજીકથી પોતાની કાર ચલાવી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક અજાણ્યો છોકરો (૨૦ થી ૨૫ વર્ષના આશરાનો) દિપકભાઈ પાસે આવી જણાવેલ કે “કાકા તમારી ગાડીમાંથી ઓઇલ ટપકે છે” તેમ કહી દિપકભાઈની નજર ચુકવી તેમની કારમાંથી ડોક્યુમેન્ટ તેમજ રોકડ રૂપિયા ૧,૨૫,૦૦૦/- સાથેનો થેલો ચોરી કરી નાસી ગયો હતો. આ અંગેની ફરીયાદ દિપકભાઈ પટેલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.જે.હુણ ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૩૧૧/૧૯

“કે” ટ્રાફિક પોલીસ સ્ટેશન: (૧) મનોજકુમાર શીવલાલ યાદવ (ઉ.વ.૩૫) (રહે. ઝેડેક્ષ ડાઈંગ કંપનીમાં સુએઝ ફાર્મની અંદર ગુલાબનગર દાણીલીમડા) તા.૧૬/૨/૧૯ રાતના ૯/૩૦ વાગ્યાના સુમારે વિશાલા સર્કલથી પીરાણા ચાર રસ્તા વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહન ચાલકે વાહન પુરઝડપે અને બેદરકારીથી ચલાવી ટક્કર મારતા ગંભીર ઈજાઓ થતા મનોજભાઈનું સ્થળ ઉપર મૃત્યુ નિપજ્યું હતું. આ અંગેની ફરીયાદ મૃત્યુ પામનારના ભત્રીજા બબલુ અનંતકુમાર યાદવે “કે” ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી જી.જે.રાઓલ ચલાવે છે.

“કે” ટ્રાફિક પોલીસ સ્ટેશન: (૨) રમેશ ઉર્ફે રાજુભાઈ ચાંદાજી રાઠોડ (ઉ.વ.૬૪) (રહે. ઠાકોરવાસ રેવતીનગર નવુપરુ જતલપુર ગામ તાલુકો-દસકોઈ) તા.૧૫/૨/૧૯ રાતના ૯/૧૫ વાગ્યાના સુમારે જતલપુર તુલસી એસ્ટેટ સામે રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણ્યા એસ.યુ.વી.મહીન્દ્રા ગાડીના ચાલકે ગાડી પુરઝડપે અને બેદરકારીથી ચલાવી ટક્કર મારતા ગંભીર ઈજાઓ થતા રમેશ રાઠોડનુ સ્થળ ઉપર મૃત્યુ નિપજયું હતુ. આ અંગેની ફરીયાદ મૃત્યુ પામનારના ભાઈ કેશરીસિંહ રાઠોડે “કે” ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે નોધાવી છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી જી.જી.રાઓલ ચલાવે છે.

બીજા માળેથી પડી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૩૧૨/૧૯

ગુજરાત યુનિવર્સિટી: બાબુસિંહ હિરાસિંહ ગેહલોત (ઉ.વ.૪૫) (રહે.કિષ્કાનગર વિભાગ-૧ કોઝી હોટલ સામે નારોલ) તા.૧૬/૨/૧૯ બપોરના ૨/૧૫ વાગ્યાના સુમારે ગુજરાત યુનિવર્સિટી એડમીન ટાવર ખાતે બીજા માળે રંગવાનુ કામ કરતા હતા ત્યારે બીજા માળેથી પડી જતા ગંભીર ઈજાઓ થતા સારવાર માટે વા.સા.હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના ડૉશ્રીએ મૃત જાહેર કર્યા હતા. આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે અકસ્માત મોત નોધી આ અંગેની તપાસ પો.સ.ઇ.શ્રી ડી.કે.ઠાકોર ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.